

Date: 13.11.2024

To,
Gen. Manager (DCS)
BSE Limited.
P J Towers, Dalal Street,
Fort, Mumbai-400001

SUB: INTIMATION OF ADVERTISEMENT IN NEWSPAPER UNDER REGULATION 47 OF SEBI (LISTING OBLIGATIONS AND DISCLOSURE REQUIREMENTS) REGULATIONS 2015.

REF: COMPANY CODE BSE: 531257 (PRATIKSHA CHEMICALS LIMITED)

Dear Sir,

Please find enclosed herewith copy of Advertisement given in newspaper of unaudited financial results for the quarter ended on 30th September, 2024 in compliance of Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The said unaudited financial results were reviewed by Audit committee and approved by the Board of Directors at its meeting held on **12th November, 2024**.


You are requested to take the same on your record.

Thanking You.

Yours Sincerely,

FOR, PRATIKSHA CHEMICALS LIMITED

**MR. JAYESH PATEL
DIRECTOR
(DIN: 00401109)**



PRATIKSHA CHEMICALS LIMITED

Regd. Off : 3rd Floor, H. K. Complex , Nr. Dharnidhar Derasar, Paldi, Ahmedabad-380 007 India
Ph. 26632390, 26609530 Fax No : +91 79 26612843.

Website : <http://www.dharapratiksha.com> E-mail : exports@dharapratiksha.com

CIN : L24110GJ1991PLC015507

Factory : 195/2, Near Natraj Industrial Estate, Village Iyawa Vasna, Sanand.
(Dist : Ahmedabad) India. Phone 02717-284350

CHANAKYA

NI POTH

Razorpay launches venture investment programme in partnership with VCs

Fintech player Razorpay on Wednesday launched the Razorpay Venture Investment Programme in collaboration with venture capital firms Peak XV and Lightspeed to invest in over 50 early-stage business-to-business (B2B) companies.

The company and its VC partners will invest in 10-15 early-stage startups every year, providing funding, technology, and leadership support to B2B startups across various stages of development.

Early-stage ventures could see potential fundraising of up to \$1 million as part of the programme. Bengaluru-based Razorpay is an omnichannel payments and banking platform that operates in the B2B space.

"With growing interest in supporting startups within this space, India is projected to welcome an additional 10-15 unicorns in the B2B sector over the next five years," the company said in a statement.

Early-stage fintech companies will have access to Razorpay's API (Application Programming Interface) stack and sandbox environments. This will include introductions to the distribution network, product partnerships, and customer connections.

The leadership team, including the company's founders, will provide one-on-one guidance to the startups.

Nexus Select Trust Q2FY25 results: Net operating income rises 5%

Nexus Select Trust, India's first listed retail real estate investment trust (REIT), reported an annual increase of 5 per cent in its net operating income (NOI) for the second quarter of the financial year 2025 (Q2 FY25). The REIT's NOI stood at Rs 371.3 crore.

The REIT's revenue from operations increased by about 4 per cent year-on-year (Y-o-Y) to Rs 554.4 crore. However, its profit for the period declined by 56.2 per cent, to Rs 110.24 crore.

The REIT's earnings before interest, tax, depreciation, and amortisation (Ebitda) for the

quarter was Rs 397.2 crore.

Further, the REIT declared a distribution of Rs 304.1 crore, or Rs 2.01 per unit, to its unitholders.

As per the Securities and Exchange Board of India (Sebi), REITs are mandated to distribute at least 90 per cent of their taxable income.

Dalip Sehgal, executive director and chief executive officer at Nexus Select Trust, said, "We witnessed resilient financial performance in Q2 FY25 with retail net operating income growth of 5 per cent Y-o-Y in a moderate consumption

Vishnu Acharya, head of strategy and corporate development at Razorpay, will lead the programme for the startups.

"I believe the B2B space remains one of the leading areas with strong potential for growth. With the Razorpay Venture Investment Programme, we aim to ease this journey by providing access to the right technology, mentorship, and partnerships to help founders innovate and scale faster," said Harshil Mathur, co-founder and CEO, Razorpay.

Meanwhile, companies will have access to the Razorpay Rize community of more than 3,000 founders and businesses.

environment.

On the back of this performance, we are delighted to announce our fifth distribution of Rs 3,041 million, in line with FY25 projections. With a strong start to Q3 FY25, where we witnessed 18 per cent consumption growth in October 2024, we expect robust performance in the second half of FY25. We have also recorded our highest-ever one-day sales on October 27, leading up to Diwali."

Additionally, the REIT achieved tenant sales of Rs 3,000 crore in Q2 FY25, with sales momentum improving significantly in October.

Wilson & Hughes PE acquires travel firm Cox & Kings assets, brands

Iconic travel brand Cox & Kings, which went bust in 2019, is all set to make a comeback under a new owner, Singapore's private equity (PE) firm Wilson & Hughes which wants a pie of the fast growing Indian travel market.

The deal amount has not been disclosed.

The revamped company will focus on four business areas, which are leisure travel, business travel, specialised travel, and travel technology, according to a company statement.

The acquisition, completed through the PE firm's Indian subsidiary, includes only the Cox & Kings brand and assets, excluding any responsibility for financial and legal issues tied to the company's past operations.

Under previous management, Cox & Kings faced severe financial troubles, entering bankruptcy in 2019 and undergoing bankruptcy proceedings with the National Company Law Tribunal (NCLT).

Wilson & Hughes acquired the brand and its associated collateral via the National Company Law Tribunal (NCLT) process.

The deal also brings in over 200 sub-brands that were historically part of the travel company's portfolio.

"The travel industry is evolving rapidly, and we recognise the tremendous opportunity to redefine global travel experiences," said Karan Agarwal, Director, Wilson & Hughes.

"Our goal is to merge the best of tradition with forward-thinking technology by leveraging advanced technology, AI, and data-driven insights," Agarwal said.

The travel industry in India is expected to hit \$125 billion by 2027 and this deal marks Wilson & Hughes' first major foray into travel, leveraging its experience in sectors like finance, FMCG, and hospitality to elevate Cox & Kings in a competitive market.

With a renewed emphasis on luxury, the company will focus on integrating advanced technology, including AI, machine learning, and data analytics, to create tailor-made journeys for travellers that anticipate their needs and enhance the traditional travel experience, stated the release.

SoftBank returns to quarterly profit with \$7.7 bn gain, beats expectations

Japan's SoftBank Group swung to a 1.18 trillion yen (\$7.7 billion) net profit in the three months to September, as the tech giant benefitted from higher share prices of listed companies in its Vision Fund investment vehicles.

The results handsomely beat expectations of a 287 billion yen (\$1.87 billion) profit based on the average of four analyst estimates compiled by LSEG, and compares with a loss of 931 billion yen in the same period last year.

SoftBank's more cautious approach to investment is bearing some fruit. Masayoshi Son's investing juggernaut was forced into a prolonged period of retrenchment when interest

rate hikes caused the value of its holdings in high-growth tech start-ups to crater.

Now some of these

A recovery of the yen against the dollar over the quarter generated a gain of 289 billion yen as dollar-denominated liabilities could be funded more readily in yen.

valuations are beginning to recover, pushing the Vision Fund unit to an investment gain of 608 billion yen.

In four of the last five quarters the unit has been in the black.

But while Vision Fund 1 has had a gross gain of \$22.6 billion since inception this has been largely offset by Vision Fund 2's \$21 billion loss.

A recovery of the yen against the dollar over the quarter generated a gain of 289 billion yen as dollar-denominated liabilities could be funded more readily in yen.

Hyundai Motor India Q2 PAT down 16%

Hyundai Motor India (HMLI), recently listed on Indian stock exchanges, reported a 15.5 per cent decline in profit after tax (PAT) for the second quarter (Q2) of 2024-25 (FY25), primarily due to weak market sentiment and geopolitical factors. Revenue from operations fell 7.5 per cent year-on-year (Y-o-Y) to Rs 17,260 crore in Q2FY25.

The company reported an earnings before interest, tax, depreciation, and amortisation (Ebitda) of Rs 2,205 crore, with an Ebitda margin of 12.8 per cent, a 9.6 per cent decrease Y-o-Y.

HMLI stock dropped 0.98 per cent to Rs 1,804.45 per share on the BSE, a sizeable decline from its listing price of Rs 1,931 per share.

Unsoo Kim, managing director of HMLI, announced that the company would soon introduce a dividend payout policy. He expressed confidence in the long-term value of HMLI stock. HMLI is focusing on premiumisation: sunroofs now represent 53 per cent of sales in the first half (H1) of FY25, up from 47.4 per cent in H1 of 2023-24.

Automatics now constitute 25.3 per cent of sales, and 14.4 per cent of Hyundai vehicles sold in India are equipped with advanced driver assistance systems. Sport utility vehicles (SUVs) account for 68.6 per cent of Hyundai's total sales, up from 60 per cent last year.

In Q2, the company sold 191,939 passenger vehicles, including 149,639 units in the domestic market, driven primarily by SUV sales. Export volume stood at 42,300 units.

GIC Re Q2FY25 results: Net profit increases 16% to Rs 1,860.76 crore

The domestic reinsurer, GIC Re's net profit rose by 15.9 per cent year-on-year (Y-o-Y) to Rs 1,860.76 crore in Q2 FY25 from Rs 1,605.09 crore in the year-ago period, driven by healthy growth in investment income and a decline in commission.

Sequentially, the net profit rose by 74.4 per cent from Rs 1,036.06 crore in Q1 FY25.

The domestic reinsurer, GIC

Kim said, "Despite sluggish market conditions, we have maintained profitability in H1FY25 due to proactive and continuous cost-control measures. We will launch the Creta EV (electric vehicle) for the mass market, which we expect to be a game-changer in the EV market."

The export market, particularly in West Asia, has faced challenges due to the Red Sea crisis. Hyundai's average selling price in the domestic market during Q2 stood at Rs 7.7 lakh, compared to Rs 7.5 lakh in export markets.

Tarun Garg, chief operating officer of HMLI, projected that rural growth will outpace urban growth. Rural sales have shown strong performance this year, supported by good monsoons and high minimum support prices. Rural sales now account for 21 per cent of Hyundai's overall sales, up from 20 per cent last year.

The Indian market has grown by 3.9 per cent between January and October this year, and Garg expects low single-digit growth in the second half of FY25.

We have access to Hybrid tech: MD Unsoo Kim, managing director of HMLI, said on Tuesday that Hyundai Motor Corporation offers successful hybrid models in markets like the US. "HMLI has access to this technology and is positioned to launch hybrids in India depending on market demand," Kim said. Competitors Maruti Suzuki and Toyota currently lead in India's hybrid market, viewing hybrids as a bridge between internal combustion engines and electric vehicles.

cent to Rs 7,603.76 crore.

The solvency ratio of the reinsurer as on September 30, 2024, stood at 342 per cent, compared to 282 per cent as on September 30, 2023. The combined ratio of the company narrowed to 114.05 per cent from 115.83 per cent during the same period.

The underwriting loss of the company narrowed by 26



Re's net profit rose by 73 per cent Y-o-Y to Rs 420.38 crore in Q2 FY25 from Rs 242.51 crore in the year-ago period, on the back of healthy growth in investment income and a fall in commission.

Sequentially, the net profit rose by 17.8 per cent from Rs 356.8 crore in Q1 FY25. The investment income of the company grew by 6.6 per cent to Rs 3,483.34 crore. However, the commission dropped by 9.67 per cent to Rs 1,493.68 crore. The net premium of the company declined by 23.71 per

cent to Rs 1,088.43 crore from Rs 1,471.61 crore.

Meanwhile, during the first half of FY24, the total assets stood at Rs 1.94 trillion as on September 30, 2024, compared to Rs 1.67 trillion as on September 30, 2023.

Recently, GIC Re has been identified as a Domestic Systemically Important Insurer (D-SII) by the insurance regulator Irdai. It holds a rating of A- (Excellent) with a Stable Outlook Financial Strength Rating by AM Best.

RIL to invest Rs 65,000 crore in 500 CBG plants in Andhra Pradesh

Mukesh Ambani-promoted Reliance Industries (RIL) on Tuesday signed a memorandum of understanding (MoU) to invest Rs 65,000 crore in setting up of 500 compressed biogas (CBG) plants in Andhra Pradesh (AP).

"Today, the GoAP has signed a landmark MoU with Reliance Industries, securing a ₹65,000 cr investment for Compressed Bio Gas (CBG) projects. This partnership is set to generate 2.5 lakh employment opportunities in our State. Out of Reliance's national target of 2,000 CBG plants, 500 state-of-the-art CBG plants will be built throughout Andhra Pradesh over the next three years.

This will make our state a frontrunner in clean energy and sustainable development. With Reliance's commitment to enhancing lives and livelihoods in AP, this partnership will also drive growth across multiple sectors. By attracting such transformative investments, our Integrated Clean Energy Policy is proving instrumental in positioning our State as a preferred destination for industries — a swing in AP's favour," Chief Minister Chandrababu Naidu said in a tweet.

AP's Minister for Education, Information Technology and Electronics

L&T bags over Rs 15,000 crore NTPC order for thermal power plants

Engineering conglomerate Larsen & Toubro (L&T) on Tuesday informed the exchanges that it has received a 'limited notice to proceed' (LNTP) from NTPC for setting up thermal power plants worth over Rs 15,000 crore.

L&T does not disclose the exact value of its order wins. However, analysts estimate it to be around Rs 22,000 crore.

According to people in the know, this is one of the biggest order wins for L&T in the domestic market, similar to a bullet-train package order that it won in 2020.

In its Tuesday statement, L&T said these power plants are being set up in Madhya Pradesh and Bihar. In a separate statement to BSE, BHEL said it has an order for 3x800 megawatt (Mw) Telangana

Nara Lokesh said the foundation for this maiden biofuel project in the State will be laid on December 28 at Kanigiri in Prakasam district.

The MoU was signed by representatives of RIL and senior officers of the State government at the Secretariat in the presence of Naidu.

This is by far RIL's biggest investment announcement for the CBG segment. To put the 500 CBG plants number into perspective, there are only 109 functional CBG/Bio CNG plants in India, according to GOBARDHAN (Galvanising Organic Bio-Agro Resources Dhan) data.

In its FY24 annual report, RIL said it has launched the first commercial-scale CBG plant in Barabanki, Uttar Pradesh (UP), and plans to expand to 25 CBG plants across India, with a goal for 100 CBG plants in the next five years.

UP is also the chosen ground for RIL's only other competitor in the CBG segment, Gautam Adani-promoted Adani Total Gas, which has so far supplied 208 tonnes of CBG to GAIL from its Barsana unit in the State.

CBG can be blended as a cleaner fuel with other fossil-based gases such as compressed natural gas (CNG),

the primary driver of the recent rise in investments in this space. Industry estimates put India's current Bio-CNG potential at 32 million tonnes.

Gaurav Kedia, chairman for Indian Biogas Association, noted that ballpark CBG is 20 per cent cheaper to procure compared to fossil-based gas CNG. However, he added: "The 20 per cent margin is absorbed at the oil marketing company (OMC) level, so anyone producing and selling CBG to OMCs will need to negotiate their own margins."

On the profile of off-takers for such a production, Kedia said: "Retail outlets that sell to OMCs or other users of natural gas are the likely off-takers for CBG production. In addition to off-take, a large-scale investment will trickle down the benefits to engineering, farming, and pipeline infra companies that will help set up these CBG units."

According to people in the know, with its CBG produce, RIL may cater to a mix of segments, including captive and commercial use. Further, RIL has also started retailing CBG through its own outlets. As of September, through Reliance BP Mobility Limited (RBML), RIL had expanded its CBG network to 28 sites retailing Bio-CNG, according to its October earnings press statement.

Stage-II supercritical thermal power plant, the third plant in this bundle from NTPC.

L&T's order pertains to the 2x800 Mw Stage-II thermal power plant at Gadgarwara in Madhya Pradesh and 3x800 Mw



Stage-II thermal power plant at Nabinagar, Bihar.

The order win also marks a change in L&T's strategy, where the company earlier said it will not participate in bids for thermal power units.

In a media call in October, Subramanian Sarma, whole-

time director & president (energy), L&T, said the change in strategy came after fruitful discussions over earlier stated unfavourable terms and conditions in the bidding process.

As of September, L&T's total order book under execution was at Rs 5.1 trillion, with 40 per cent of it emerging from the international market, particularly West Asia.

In October 2020, L&T won an order to construct the 237.1 km stretch of MAHSR - C4 package, which is part of the Mumbai Ahmedabad High-Speed Rail Project.

Back then, L&T said this was the biggest engineering, procurement and construction (EPC) contract it won in India. The Tuesday project win is on similar lines in terms of value, said people in the know.

PRATIKSHA CHEMICALS LIMITED					
REGD. OFFICE: 3RD FLOOR, H K COMPLEX, OPP. DHARNIDHAR DERASAR, VASNA, AHMEDABAD - 380007					
CIN : L24110GJ1991PLC015507					
PH : 079-26632390					
www.pratikshachemicals.in					
E-MAIL: exports@gharapratiksha.com					
EXTRACT FROM THE STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30.09.2024 (Rs. In Lacs)					
Sr. No	PARTICULARS	Quarter ended on 30-09-2024	For the quarter ended on 30-09-2023	Half year ended on 30-09-2024	Year ended on 31-03-2024
1	Total income from operations	165.53	161.25	391.36	1,034.67
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(11.93)	3.07	(7.87)	11.45
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	(11.93)	3.07	(7.87)	11.45
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	(13.00)	1.77	(17.83)	5.30
5	Total Comprehensive Income for the period [Comprising Profit/ (loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	(13.00)	1.77	(17.83)	5.30
6	Equity Share Capital	557.03	557.03	557.03	557.03
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of Previous Year	(193.99)	(199.28)	(193.98)	(193.98)
8	Earnings Per Share (of Rs. 10 / - each) (for continuing and discontinued operations)	(0.23)	0.03	(0.32)	0.10
	Diluted :	(0.23)	0.03	(0.32)	0.10

Notes:
1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing and Other Disclosure Requirements) Regulation, 2015. The full Format of the financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and on the Company website (www.pratikshachemicals.in)
2. The result of the Quarter ended on 30th September, 2024 were reviewed by the Audit Committee and approved by the Board of Director at its meeting held on 12th November, 2024.

BY ORDER OF THE BOARD OF DIRECTORS,
FOR, PRATIKSHA CHEMICALS LIMITED
SD/-
Mr. JAYESH PATEL
DIRECTOR
(DIN : 00401109)

Place : Ahmedabad
Date : 12th November, 2024

ધી જ્યુઝલાઇઝ

વર્ષ : ૩૧ અંક : ૬૩ તા.૧૩-૧૧-૨૦૨૪ પાનાં ૪ માલિક : જયની પબ્લીશર્સ તંત્રી : રણછોડ એન. શાહ સહ તંત્રી : રાધિકા ગંજવાલા

સેન્સેક્ષ હવે અપટ્રેન્ડમાં દાખલ થવાની તૈયારીમાં

ખેલાડીઓ કેટલાક નવા સેક્ટરમાં સક્રિય થશે



યાજ્ઞકયા દિવાળી અંક વખતે સ્પષ્ટ શબ્દોમાં દર્શાવેલું કે નવા વર્ષના પ્રારંભથી જ તેજનો પ્રારંભ થઈ જશે અને તે મુજબ સેન્સેક્ષ-નિકેટી હવે ક્રેકશનના છેલ્લા તબક્કામાં આવી ગયા છે અને ગમે ત્યારે બજાર ફરી એક વખત મજબૂત અપટ્રેન્ડમાં દાખલ થાય તે સંભાવના મજબૂત છે, પરંતુ આ વખતના ઉછાળા વખતે અગાઉના સેક્ટરોને ભૂલીને ખેલાડીઓ કેટલાક નવા સેક્ટરમાં સક્રિય થશે તેમ સ્પષ્ટ રીતે દેખાય છે.

સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય ચિત્રની વાત કરીને તો અમેરિકામાં ચૂંટણીઓ

વિસ્તારોમાંથી પોતાનું સૈન્ય પાછું ખેંચવાની સૂચના પણ આપી દીધી છે. જ્યારે ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ હજી થોડો સમય ચાલુ રહેશે અને તેમાં ઈઝરાયેલ દ્વારા હમાસ અને અન્ય કેટલાક આતંકી દળોનો પાતમો કરી દેવા ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેવાની ગણતરી છે અને તેનો સીધો અર્થ એ થયો કે આ વખતે અમેરિકન પ્રમુખ તેમના દેશની ડિક્લેરેશન કંપનીઓના હાથ નહિ બને અને બીજા અર્થ એ થયો કે ભારતમાં પણ ડિક્લેરેશન કંપનીઓની ચમક સ્પષ્ટ રીતે ખતમ થઈ જશે. ચાણક્યમાં તો છેલ્લા ત્રણ મહિનાથી ડિક્લેરેશન શેરોમાંથી નીકળતા જવાનું દર્શાવીએ છીએ કારણ કે મોટા ભાગના ડિક્લેરેશન શેરોમાં વેલ્યુએશન અતિશય મોંઘા થઈ ગયા છે અને તેમાં હવે વધારે ઉપર જવાની જગ્યા નહોતી અને સાથે સાથે શેરબજારના ખેલાડીઓને થોડા થોડા સમયે નવા સેક્ટરની શોધ હોય છે. અને તેથી તમારે પણ હવે ડિક્લેરેશન શેરો તરફનું આકર્ષણ ભૂલીને અન્ય સેક્ટરમાં પોતાનું ફોકસ વધારવું આવશ્યક છે.

બીજી તરફ કમ્પ્યુટર લક્ષી શેરોનું આકર્ષણ પણ ખતમ થઈ જવાનું. આ વખતના એકએમસીજી કંપનીઓના અને વપરાશ આધારિત કંપનીઓના આંકડા તમે જોશો તો તેમાં સ્પષ્ટ રીતે સપ્ટેમ્બર ક્વાર્ટર દરમ્યાન લગભગ આઠમી કંપનીઓના વેચાણો અને નફાઓમાં ઘટાડો જોવાયો છે. ચાણક્યના આ અંકમાં રેમ્પન લાર્ડફક્સના નફાનો વિસ્તૃત એનાલિસિસ આર્યુ છએ અને તેમાં પણ સ્પષ્ટ રીતે દેખાય છે કે સ્ટોર સંખ્યામાં નોંધપાત્ર વધારો થવા છતાં રેમ્પન લાર્ડફક્સનો વેચાણો અને નફાનો ઘટાડો જોવાયો છે. આ તો એક શેરની વાત થઈ પરંતુ શહેરી માંગના સ્લોડાઉનને કારણે કમ્પ્યુટર શેરો તરફનું આઉટલુક હવે બદલાઈ રહ્યું છે તેમ મની કન્ટ્રોલના એનાલિસિસમાં પણ દર્શાવાયું છે અને તેથી આગામી સમયગાળામાં ડિક્લેરેશન યુનિલિવર, ડાબર વગેરે એકએમસીજી શેરોમાંથી આકર્ષણ ઘટશે તેમ સ્પષ્ટ રીતે દેખાય છે અને આ આકર્ષણ હવે મુખ્યત્વે બેંકિંગ અને ઈ-કોમર્સ શેરોમાં શિફ્ટ થઈ જવાનું જે રીતે ડિક્લેરેશન શેરોએ તમને છેલ્લા બે વર્ષ દરમ્યાન અફલાતૂન રિટર્ન આપ્યું હતું તેવું જ રિટર્ન હવેના ૧૮થી ૨૪ મહિના દરમ્યાન ઈ-કોમર્સ અને એનસીપીની શેરોમાં મળશે તેમ સ્પષ્ટ રીતે દેખાય છે અને તેથી ઝોમેટો, સ્વીડી, ફર્સ્ટ કાય, કમ્પ્યુટર એજ મેનેજમેન્ટ, કેલિન ટેકનોલોજીસ વગેરે શેરો ઉપર ફોકસ વધારતા જવું અને સાથે સાથે બેંકિંગ શેરો અને ખાસ કરીને સરકારી બેંક શેરો ઉપર ફોકસ વધારવું અને તે શેરો મલ્ટીબેગર બની રહેવાની ગણતરી છે. ભારતમાં અત્યારે અન્ય કોઈ ઉવલપમેન્ટ નથી અને તમામ પક્ષો અત્યારે મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી ચૂક્યા છે. ભારતમાં બે રાજ્યોમાં મોટા ભાગના ઉદ્યોગપતિઓ અને પૈસાની કોથળીવાળા વસી રહ્યા છે અને તેમાં હરિયાણામાં ગુરુગાંવમાં તો ભાજપની સરકાર આવી ગઈ, પરંતુ અન્ય ઔદ્યોગિક રાજ્યોની મુંબઈમાં આ વખતે ભાજપની સરકાર આવશે કે પછી કોંગ્રેસ ઉદ્ભવ ઠાકરે અને એનસીપીની સરકાર આવશે તે પ્રશ્ન છે. બહુમતી એનાલિસિસની મતલબ છે કે કોંગ્રેસ ઉદ્ભવ ઠાકરે અને એનસીપીની સરકાર આવશે પરંતુ જે રીતે છેલ્લી ધરીએ હરિયાણામાં કોથળામાંથી બિલાડું નીકળ્યું તે રીતે મહારાષ્ટ્રમાં પણ ઈવીએમનો ખેલ થઈ જાય અને તે રીતે પરિણામો જૂદા થઈ તેને કારણે કોઈ પણ રાજકીય નિષ્પાત્ર કે રાજકીય પક્ષ છાની કીકીને કહેવા તૈયાર નથી. અને તેથી નવેમ્બર આખરના પરિણામ આવે ત્યાં સુધી આપણે પણ રાહ જોવી પડશે. બાકી આર્થિક બાબતો અંગેની વીકી કોઈ જાહેરાત

હતું અને તે પછી વધીને રૂ. ૧૧૮ ઉપર આવ્યો છે. યુનિયન બેંકમાં પણ છેલ્લા ૧૨ મહિનાની નફાશક્તિ ૨૮.૭૪ ટકા વધી છે, પરંતુ તેની સામે શેર કેવળ ૫.૮૮ના નીચા વેલ્યુએશન ઉપર પડી રહ્યો છે અને આ શેરમાં નાખી દેતા રૂ. ૧૦૦થી રૂ. ૧૮૦નો ભાવ આગામી મહિનાઓમાં દેખાય છે અને તેથી તે શેરમાં પણ નાનું રોકાણ કરી શકાય.

દક્ષિણ ભારતના ગ્રાહકોમાં ખૂબ પોપ્યુલર **ઈન્ડિયન બેંક**નો શેર રૂ. ૫૬૭ ઉપર છે. ઈન્ડિયન બેંકના નફામાં ૪૩ ટકાનો સુંદર ઉછાળો જોવાયો છે અને આ શેરમાં અત્યારે એનપીએન કેવળ ૦.૨૭ ટકાના લેવલે પહોંચી ગઈ છે. એટલે કે ફક્ત રૂ. ૧૪૪૫ કરોડની એનપીએ બાકી છે. સપ્ટેમ્બર ક્વાર્ટર દરમ્યાન ઈન્ડિયન બેંક દ્વારા રૂ. ૧૦૯૮ કરોડની એનપીએ માંડવાળ કરાઈ હતી અને તે રીતે હવે એક કે બે ક્વાર્ટરમાં જ બાકીની એનપીએનો પાતમો થઈ જવાનો અને તેથી આ બેંકની નફાશક્તિમાં પણ તોતિંગ ઉછાળાની જગ્યા છે. ૭૪ ટકા મૂલ્ય તો સરકાર પાસે છે અને તેથી આ શેરમાં પણ આવતા ફથી ૧૨ મહિનામાં તોતિંગ રિટર્નની જગ્યા છે. ચૂપચાપ થોડાક ઈન્ડિયન બેંકના શેર લઈને મૂકી દેજો.

એટ્લ બેંક ઓફ ઈન્ડિયાનો શેર રૂ. ૫૭ ઉપર ચાલે છે અને આ બેંકનો નફો પણ છેલ્લા ૧૨ મહિનામાં ૫૬.૮૫ ટકા વધ્યો છે. પરંતુ તેની સામે શેર અત્યારે ૧૪.૪૮ના પીઈશિયો ઉપર પહોંચી ગયો છે. અને તેથી આ શેરમાં વધવાની જગ્યા થોડીક મર્યાદિત છે તેમ છતાં આ શેરની મૂલ્યમેન્ટ પણ ખાસ ધ્યાનમાં રાખવી સલાહભર્ય છે.

ઈન્ડિયન ઓવરસીઝ બેંક પણ અત્યારે રૂ. ૫૪ ઉપર ચાલે છે અને તેના નફામાં છેલ્લા ૧૨ મહિનામાં ૨૬.૮૨ ટકાનો ઉછાળો આવ્યો છે. આ શેર પણ થોડોક મોંઘો છે અને તેથી તેમાં ઉછાળાની જગ્યા મર્યાદિત છે.

સરકારી બેંકોની આગેવાન **સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા** રૂ. ૮૫૮ ઉપર છે અને નિકેટી અને સેન્સેક્ષમાં જંગી વેઈટજ ધરાવતા સ્ટેટ બેંકના શેરમાં અત્યારે ૧૧.૧૦નો પીઈશિયો ચાલે છે. પ્રાથમિક નજરે આ શેરમાં ઉછાળાની જગ્યા મર્યાદિત લાગે, પરંતુ સ્ટેટ બેંક અત્યારે સ્પષ્ટ રીતે રીટર્નિંગના તબક્કામાં દાખલ થઈ ગયો છે અને તેથી આ શેર ઉપર ખાસ ફોકસ રાખવું. આગામી મહિનાઓમાં આ શેરમાં સુંદર ઉછાળા સાથે ઉપરમાં રૂ. ૯૨૦નો ભાવ થોડા અઠવાડિયામાં જોવા મળે તેવી ગણતરી છે. અને તેથી નાનું રોકાણ આ શેરમાં પણ કરી શકાય.

સામે પક્ષે **આઈડીએફસી ફર્સ્ટ બેંક** અત્યારે રૂ. ૬૬-૬૭ ઉપર વધત હતાવે છે અને તે શેરમાં લાંબો કસ નથી દેખાતો. જ્યારે રૂ. ૨૦૬ના ભાવની **ફેડરલ બેંક**ના શેરમાં પણ કસ ઓછો છે.

બેંક ઓફ મહારાષ્ટ્ર કે જેના શેર અંગે પણ અંકે અંકે ઈન્વેસ્ટરો ખૂબ જ આકર્ષણ ધરાવે છે તેનો શેર રૂ. ૫૪-૫૫ ઉપર ચાલે છે અને તેનો નફો છેલ્લા ૧૨ મહિનામાં ૩૨ ટકા વધ્યો છે, આ શેરમાં પણ રીટર્નિંગ જૂથ છે અને તેમાં પણ આગામી સમયગાળામાં સુંદર વૃદ્ધિ ગણતરી છે. ૭૦નો ભાવ જોવા મળે તેવી ગણતરી છે અને તેથી નાનું રોકાણ કરી શકાય.

પ્રાઈવેટ બેંકોમાં મુખ્ય આકર્ષણ ટોચની પાંચ પ્રાઈવેટ બેંકોમાં જ જોવા મળવાની ગણતરી છે. મીડસાઈઝ પ્રાઈવેટ બેંકોમાં કસ ઓછો છે અને તેમાં મર્યાદિત રિટર્ન જ અપેક્ષિત છે.

સંભાવના સ્પષ્ટ છે. આનો જ સુંદર ઉછાળો આગામી સમયગાળામાં **આઈસીઆઈસીઆઈ બેંક**ના શેરમાં પણ દેખાય છે. અત્યારના રૂ. ૧૨૬૬વાળા શેરમાં મોટો ઉછાળો નથી અપેક્ષિત. ધીમા સુધારા સાથે આવતા થોડા મહિનામાં રૂ. ૧૫૦૦ આસપાસનો ભાવ જોવા મળે તેવી ગણતરી છે.

ઈન્ડિયન બેંકમાં પરિણામો પછી તીવ્ર ઘટાડો જોવાયો અને આ શેર તેના ભાવન અઠવાડિયાના બોટમ રૂ. ૧૦૧૮ની સામે રૂ. ૧૦૫૫ ઉપર ચાલે છે અને નવા વર્ષમાં એક કે બે ક્વાર્ટરના સારા પરિણામો પછી જોરદાર રીટર્નિંગ અને ઉપરમાં રૂ. ૧૫૦૦નો ભાવ જોવા મળે તેવી ગણતરી છે એટલે કે અત્યારના ભાવથી લગભગ ૫૦ ટકા રિટર્ન આવતા ૧૨ મહિનામાં જૂથ છે અને તેથી તે શેર ઉપર પણ ફોકસ રાખવું.

પ્રાઈવેટ સેક્ટરની પાંચમી સૌથી મોટી બેંક **કોટક મહિલા બેંક** અત્યારે રૂ. ૧૭૫૫ ઉપર ચાલે છે અને તેમાં પણ નવા વર્ષમાં જોરદાર રીટર્નિંગની જગ્યા છે. કોટક બેંકમાં નવા વર્ષ દરમ્યાન તેના ઈન્વેસ્ટમેન્ટ, સ્ટુડન્ટ વગેરે બિઝનેસનું અનલોડિંગ અપેક્ષિત છે. અત્યારે રૂ. ૧૭૫૪વાળા આ શેરમાં નવા વર્ષમાં ૧૦૦ ટકા રિટર્ન છૂટશે તેમ સ્પષ્ટ રીતે દેખાય છે અને તેથી એક્સિસની સાથે સાથે થોડાક કોટક બેંકના શેર પણ લઈને મૂકી શકાય અને નવા વર્ષમાં તે શેર પણ તમને જોરદાર રિટર્ન આપી શકશે.

અન્ય પ્રાઈવેટ સેક્ટરની નાની બેંકોમાં **સિટી યુનિયન બેંક**નો શેર રૂ. ૧૮૧ ઉપર છે અને તેમાં ૪૦થી ૫૦ ટકા રિટર્નની જગ્યા છે અને તેથી થોડાક શેરો લઈને મૂકી શકાય. પરંતુ માર્કો ફિનાન્સના ધંધા ઉપર ફોકસ ધરાવતી બેંચ બેંક અને અન્ય સ્મોલ ફિનાન્સ બેંકોમાં કોઈ લાંબો કસ નથી દેખાતો અને તેથી તે શેરોમાં પડવા જેવું નથી.

આ તબક્કે **આઈડીબીઆઈ બેંક**નો પણ ઉલ્લેખ કરવો પડે. નફાશક્તિમાં ધીરે ધીરે સુધારો શરૂ થયો છે. છેલ્લા ઘણા ક્વાર્ટરથી દરેક ક્વાર્ટરમાં જંગી નુકસાન બતાવતી આઈડીબીઆઈ હવે નફામાં આવી છે અને તેમાં હવે રીટર્નિંગ સાથે રૂ. ૮૩વાળો શેર ધીરે ધીરે રૂ. ૧૨૦ તરફ આગળ વધવાની ગણતરી છે અને તેથી થોડાક શેરો લઈને મૂકી દેજો, લગભગ ૪૦થી ૫૦ ટકા રિટર્ન આ શેરમાં અપેક્ષિત છે અને આ રિટર્ન ઓછું ન કહેવાય. મીડસાઈઝ પ્રાઈવેટ સેક્ટર બેંકોમાં પ્રેમવત્સની **સીએસબી બેંક** પણ ખાસ ધ્યાન ખેંચે છે. રૂ. ૪૨૨ના ટોપની સામે ભાવ અઠવાડિયામાં રૂ. ૨૮૨નું બોટમ બતાવ્યું અને અત્યારે રૂ. ૩૧૦ ઉપર મળે છે. આ શેરમાં પણ થોડુંક રોકાણ કરી દેજો અને અત્યારના ભાવથી આ શેરમાં પણ આવતા ૧૨ મહિનામાં તમને ૫૦ ટકા રિટર્ન આપવાની તક ધરાવે છે.

તાનિમલ મર્કનના શેરમાં પણ થોડુંક રોકાણ કરી શકાય. અત્યારે રૂ. ૪૪૩ ઉપર છે અને તેમાં નવા વર્ષમાં લગભગ ૩૦થી ૪૦ ટકા રિટર્નની જગ્યા દેખાય છે.

બેંકિંગ શેરોમાં સૌથી વધારે આકર્ષણ **યસ બેંક**ના શેર તરફ રહ્યું છે. છેલ્લા એક વર્ષથી જાપાનની બેંક અથવા

તો દુબઈની બેંક યસ બેંકને હસ્તગત કરી લેશે તેવી ગણતરીઓ પાછળ આ શેર એક તબક્કે રૂ. ૩૨.૮૫ સુધી પહોંચી ગયો હતો પરંતુ રિઝર્વ બેંક દ્વારા કોઈ કારણસર આ બંને પાર્ટીઓને કેન્સલ કરી નાખી અને તેને કારણે શેર અત્યારે ઘટીને રૂ. ૨૦.૬૬ ઉપર આવી ગયો છે. પરંતુ સામે પક્ષે યસ બેંકનો છેલ્લા ૧૨ મહિનાનો નફો ૧૧૩.૬૪ ટકા વધ્યો છે. અને છેલ્લા ૧૨ મહિનાની શેરટીક કમાણી ૫૭ પૈસા હાંસલ થઈ છે. આ ટ્રેન્ડ ધ્યાનમાં રાખીએ તો સને ૨૦૨૪-૨૫ દરમ્યાન ૭૫ પૈસાની શેરટીક કમાણી હાંસલ થવાની સંભાવના મજબૂત છે. સામે પક્ષે એનપીએ સપ્ટેમ્બર આખરે રૂ. ૧૧૬૮ કરોડ બાકી રહી છે. એટલે કે આવતા બે કે ત્રણ ક્વાર્ટરમાં તેની એનપીએ શૂન્ય સુધી પહોંચી શકે છે. સામે પક્ષે એનપીએ નીકળી જતા સને ૨૦૨૫-૨૬થી સ્વચ્છ બેલેન્સશીટ સાથે રૂ. ૧ની શેરટીક કમાણી બતાવે તેવી ગણતરી છે અને તેથી અત્યારના રૂ. ૨૦-૨૧ વચ્ચેના ભાવે આ શેરમાં યથાશક્તિ માલ ભેગો કરતા જજો. જાપાનની બેંક આવે કે પછી દુબઈની બેંક આવે કે પછી તાતા, બિરલા કે રિલાયન્સ દાખલ થાય, પરંતુ આ શેરમાં તમને સંવત ૨૦૨૧ દરમ્યાન ફીટ રૂ. ૩૦ વધસનો ભાવ જોવા મળશે તે નક્કી છે એટલે કે ૫૦ ટકા ઉપરનું રિટર્ન થયું અને આજથી પાંચ વર્ષ પછી પાંચ વર્ષનો ભાવ હોય તો પણ નવાઈ નહિ લાગે. એટલું ન ભૂલતા કે આ જ યસ બેંકમાં અગાઉના વર્ષોમાં એક તબક્કે રૂ. ૩૦૦-૪૦૦ વચ્ચેનો ભાવ ચાલ્યો હતો.

આ એનાલિસિસ ફાઈલ કરીને મૂકી દેજો અને વર્ષ પછી ચોકસપણે ચેક કરી લેવું.

એક્સચેન્જ શેરોમાં આગામી સમયગાળામાં **ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ**નો શેર ખાસ ધ્યાન ખેંચે છે.

છેલ્લા ૧૨ મહિનાનો નફો ૨૦ ટકા વધ્યો અને તેની સામે શેર અત્યારે રૂ. ૨૦.૨૭ના પીઈશિયો ઉપર મળે છે. ભારતમાં ફરી એક વખત નવા પાવર પ્લાન્ટ ઊભા કરવા ઉપર સરકાર અને પ્રાઈવેટ સેક્ટરે પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સાથે સાથે રીન્યુએબલ એનર્જીને કારણે એનર્જી એક્સચેન્જની માંગ ખૂબ જ ઝડપથી વધી છે. રીન્યુએબલ એનર્જી એટલે કે સોલર અને વિન્ડ પાવર ઉત્પાદકો ખૂબ જ નાના-નાના જથ્થામાં હોય છે. કચ્છમાં થોડીક વિન્ડમીલ આવી હોય તે માણસને પોતાનો પાવર વેચવા બાકે એનર્જી એક્સચેન્જ સિવાય કોઈ વિકલ્પ નથી રહ્યો અને આ પાસાને કારણે આગામી સમયગાળામાં આ એક્સચેન્જનું મહત્ત્વ ખૂબ જ વધતું જશે અને તેથી ભલે છેલ્લા બે વર્ષ દરમ્યાન આ શેરમાં ખાસ રિટર્ન નથી છૂટ્યું, પરંતુ રૂ. ૧૭૩વાળો શેર આવતા બે વર્ષમાં તમને તોતિંગ રિટર્ન આપી શકે તેવી તાકાત અને સંભાવના છે અને તેથી થોડાક શેર લઈને મૂકી દેજો. આ શેરમાં અગાઉ રૂ. ૩૧૮.૬૦નું ટોપ બન્યું છે અને છેલ્લા ૧૨ મહિનામાં આ શેરમાં રૂ. ૨૪૪નું ટોપ પણ બનાવ્યું છે અને તેથી અમે જ્યારે આ શેર માટે નજીકના મહિનાઓમાં ૫૦ ટકા રિટર્ન અને મધ્યમગણે ૧૦૦ ટકા રિટર્નની વાત

ગામની ગપસપ

- ઈન્ડિયા**, સેન્સેક્ષ અને નિકેટી હવે બોટમઆઉટ થવાની તૈયારીમાં અને બેંક શેરો તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર શેરોની આગેવાની હેઠળ બજારમાં તેજનો મુડ શરૂ થવાની તૈયારી.
- સ્ટેટ બેંક**, સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો પ્રોત્સાહક, વેલ્યુએશન ફૂલ દેખાય તેમ છતાં રૂ. ૮૬૦વાળા આ શેરમાં ધીમા સુધારા સાથે રૂ. ૮૭૨ અને તે પછી રૂ. ૮૮૮ના ભાવની સંભાવના મજબૂત છે.
- એચડીએફસી બેંક**, મોટો હાથી બની ગયો છે અને તેથી ટોચી ન શકે તેમ અનેક એનાલિસ્ટોનું મતલબ, પરંતુ આ બધા એનાલિસ્ટોને આ મહાકાવ્ય હાથી ખોટા પાડશે અને હવે આ શેરમાં એકઆઈઆઈના નવા રોકાણોને પગલે મજબૂત અપટ્રેન્ડની ગણતરી, અત્યારના રૂ. ૧૭૫૦ આસપાસના ભાવે ધીમા સુધારા સાથે આવતા ચાર-છ મહિનામાં રૂ. ૨૩૦૦ના ભાવની સંભાવના મજબૂત છે.
- એપોલો હોસ્પિટલ**, પરિણામો ખૂબ જ પ્રોત્સાહક આવ્યા અને હોસ્પિટલના પેશન્ટ ટ્રાફિકમાં પણ સુંદર ઉછાળો, રૂ. ૭૪૨૪ વાળા આ શેરમાં આગામી દિવસોમાં ધીરે ધીરે રૂ. ૭૬૦૬ અને તે પછી રૂ. ૭૮૦૮નો ભાવ આવી જવાની આરએસની વાત.
- ટીસીએસ**, છેલ્લા થોડા દિવસોથી બેતરફી વધઘટનો ટ્રેન્ડ જોવાતો હતો, પરંતુ હવે ક્રેકશન પૂર્ણ થાય અને ધીમો સુધારો શરૂ થવાની તૈયારી, અમેરિકામાં નવા પ્રમુખ આવી ગયા પછી ઉદ્યોગો અને વેપાર માટે વધારે સારી જાહેરાતો અપેક્ષિત, અને ભારતની આઈટી કંપનીઓને તેનો ખૂબ જ સુંદર ફાયદો મળે, રૂ. ૪૧૫૧વાળા આ શેરમાં હવે તેજતરફી ટ્રેન્ડ જોવા મળવાની ડીએસની વાત. થોડા શેરો લઈને મૂકી દેવાય.
- એક્સિસ બેંક**, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ખૂબ જ સુંદર પરિણામો જોવાયા અને હવે આ શેરમાં તોફાની તેજ શરૂ થવાની આરએસની ગણતરી, અત્યારના રૂ. ૧૧૬૦ના ભાવથી થોડા થોડા શેરો ભેગા કરતા રહેજો અને ૧૨ મહિને અફલાતૂન રિટર્નની જગ્યા.
- કોટક બેંક**, ટોચની પાંચ પ્રાઈવેટ સેક્ટર બેંકોમાં સ્થાન ધરાવતી કોટક બેંકમાં હવે વેલ્યુઅનલોડિંગ જૂથ, રૂ. ૧૭૪૩ આસપાસ વધઘટ બતાવે છે અને તેમાં મધ્યમગણા માટે થોડું થોડું રોકાણ વધારાય, આગામી દિવસોમાં સુંદર ઉછાળાની જગ્યા.
- તાતા સ્ટીલ**, બીજા ક્વાર્ટરના પરિણામો સુંદર આવ્યા, પરંતુ આ એક એવી કંપની છે કે જેમાં કોઈ પણ ક્વાર્ટરને આધારે આવતા ક્વાર્ટરનો અંદાજ ન મૂકી શકાય. અચાનક જ મોટું નુકસાન અને અચાનક જ મોટો નફો બતાવવા માટે તાતા સ્ટીલની મેનેજમેન્ટ જાણીતી થઈ ગઈ છે તેમ છતાં આ શેરમાં શોર્ટટર્મમાં નાના સુધારાની અને બેથી ત્રણ વર્ષના સમયગાળામાં રૂ. ૪૦૦ આસપાસના ભાવની સંભાવના મજબૂત અને તેથી કેવળ લોંગટર્મ માટે શાંતિપૂર્વક પકડી રાખવાનો છે તે રીતે જ થોડાક શેરો લેવા, શોર્ટટર્મમાં મોટો આનંદ આપી જવાની સંભાવના નહિવત.
- હિન્દુસ્તાન યુનિલિવર**, એકએમસીજી શેરો તરફનું સેન્ટીમેન્ટ ખરડાયું અને તેને કારણે રૂ. ૩૦૩૫થી ગબડીને રૂ. ૨૪૭૫ ઉપર આવ્યો છે, હવે થોડાક શેરો આ ભાવે લઈને મૂકી દેજો અને આવતા અઠવાડિયાથી આ શેરમાં અપટ્રેન્ડ શરૂ થવાની ગણતરી, ધીમા સુધારા સાથે પ્રથમ તબક્કે રૂ. ૨૫૦૧ અને તે પછી ધીરે ધીરે રૂ. ૨૫૨૫નો ભાવ જોવા મળે તે સંભાવના મજબૂત છે.
- લાઈફ, બીજા ક્વાર્ટરના પરિણામો** સુંદર આવ્યા અને તેની સાથે સાથે આ શેરના ભાવમાં પણ જોવાયેલું ગાબડું, અત્યારના રૂ. ૩૧૨૦ના ભાવે જોમન નહિવત અને ત્રણ મહિના માટે થોડાક શેરો લઈને મૂકી શકાય. અત્યારના ભાવથી આ શેરમાં ચુર્ન અને ધીરે ધીરે રૂ. ૩૨૩૨નો ભાવ જોવા મળવાની સંભાવના મજબૂત છે.
- ટ્રેન્ડ**, રીટર્નલે સેક્ટરની અતિશય મજબૂત કંપની અને તેમાં પણ શહેરી માંગ ઠંડી પડી છે તે ગણતરીઓ પાછળ શેરના ભાવમાં જોવાયેલો તીવ્ર ઘટાડો, અત્યારના રૂ. ૬૫૦૫ના ભાવે જોમન નહિવત અને હવે ગમે ત્યારે ચુર્ન સાથે ઉપરમાં રૂ. ૬૯૧૧નો ભાવ જોવા મળે તેવી ગણતરી સંભાવના મજબૂત છે.
- એશિયન પેઈન્ટ્સ**, એશિયન પેઈન્ટ્સના શેરમાં રૂ. ૨૮૦૦ આસપાસ થોડા થોડા શેરો ભેગા કરવાનું શરૂ કરી દેજો.

PRATIKSHA CHEMICALS LIMITED					
REGD. OFFICE: 3RD FLOOR, H K COMPLEX, OPP. DHARNIDHAR DERASAR, VASNA, AHMEDABAD - 380007					
CIN : L24110GJ1991PLC015507 www.pratikshachemicals.in					
PH : 079-26632390 E-MAIL: exports@dharpapratiksha.com					
EXTRACT FROM THE STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30.09.2024 (Rs. In Lacs)					
Sr. No	PARTICULARS	Quarter ended on 30-09-2024	For the quarter ended on 30-09-2023	Half year ended on 30-09-2024	Year ended on 31-03-2024
1	Total Income from operations	165.53	161.25	391.36	1,034.67
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(11.93)	3.07	(7.87)	11.45
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	(11.93)	3.07	(7.87)	11.45
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	(13.00)	1.77	(17.83)	5.30
5	Total Comprehensive Income for the period [Comprising Profit/ (loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	(13.00)	1.77	(17.83)	5.30
6	Equity Share Capital Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of Previous Year	557.03	557.03	557.03	557.03
7	Earnings Per Share (of Rs. 10 / - each) (for continuing and discontinued operations)	(0.23)	0.03	(0.32)	0.10
	Basic :	(0.23)	0.03	(0.32)	0.10
	Diluted :	(0.23)	0.03	(0.32)	0.10

Notes:
1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing and Other Disclosure Requirements) Regulation, 2015. The full Format of the financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and on the Company website (www.pratikshachemicals.in)
2. The result of the Quarter ended on 30th September, 2024 were reviewed by the Audit Committee and approved by the Board of Director at its meeting held on 12th November, 2024.

BY ORDER OF THE BOARD OF DIRECTORS, FOR, PRATIKSHA CHEMICALS LIMITED

SD/-
Mr. JAYESH PATEL
DIRECTOR
(DIN : 00401109)

Place : Ahmedabad
Date : 12th November, 2024